



પોલીસ કમિશનરની કચેરી, સુરત શહેર.
પોલીસ ભવન, અઠવાલાઇનસ, સુરત શહેર-૩૯૫૦૦૧
વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦
કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪
e-mail : special.cp.sur@gmail.com



:-: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ તથા

જી.પી.એફ્ટ કલમ- ૩૭ (૪) અન્વયે કરેલ હુકમ :-:

ક્રમાંક:એસ.બી./કોરોના વાયરસ/ ૯૨/૨૦૨૧

વંચાણે લીધા

(૧) ગ્રુહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A તા. ૧૧/૦૫/૨૦૨૧

(૨) ગ્રુહ મંત્રાલય ભારત સરકારના તા.૨૯/૦૪/૨૦૨૧ ના પત્રક્રમાંક: 40-3/2020- DM-I (A) અન્વયે

૧. નોવેલ કોરોના વાયરસ (covid-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગ્રુહ મંત્રાલય ભારત સરકારના તા.૨૯/૦૪/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: 40-3/2020 - DM-I (A) થી કોરોના સંક્રમણને રોકવા અધતન સુચનો આપવામાં આવેલ છે.

૨ રાજ્યમાં covid-19 ના સંક્રમણની બાબતે ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગ્રુહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી રાજ્યમાં ૩૬ શહેરોમાં તા.૧૨/૦૫/૨૦૨૧ સુધી રાત્રી કફર્યુ અમલમાં મુકવાનુ નિર્ણય લેવામાં આવેલ.

૩. રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિની સમિક્ષા કરતા પુખ્ત વિચારણાના અંતે ગ્રુહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવેલ છે, જેથી સુરત શહેરમાં તા. ૧૨/૦૫/૨૦૨૧ રાત્રીના ૬.૨૦/૦૦ થી તા.૧૮/૦૫/૨૦૨૧ સુધી સવારના ૬.૦૬/૦૦ સુધી રાત્રી કફર્યુ લંબાવવામાં આવે છે.

સુરત શહેર વિસ્તાર વસ્તીની દ્રષ્ટીએ ગીચ અને ભીડભાડ વાળુ હોય નોવેલ કોરોના વાયરસ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩ ની કલમ ૧૪૪ અન્વયે હું અજયકુમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર નીચે મુજબનો હુકમ કરું છું.

:-:વિસ્તાર:-

સુરત શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

:-:હુકમ :-

રાત્રી કફર્યુ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.

- (૧) બિમાર વ્યક્તિ,સગર્ભાઓ,અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છુટ રહેશે.
- (૨) મુસાફરોને રેલ્વે,એરપોર્ટ ડા કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- (૩) રાત્રી કફર્યુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં.
- (૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે.
- (૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર , ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન,સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

(૭) તમામે ફેસ કવર માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે.

૪.

::નિયંત્રણો::

ગૃહ વિભાગના સમાન ક્રમાંકના હુકમથી અમલી કરવામાં આવેલ નીચે મુજબના નિયંત્રણો તા.૧૨/૦૫/૨૦૨૧ ના ક.૦૬/૦૦ થી તા.૧૮/૦૫/૨૦૨૧ ના ક.૦૬/૦૦ સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન સુરત શહેરમાં લંબાવવામાં આવે છે.

૧. આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારિક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણીજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (Take away service સિવાય), તમામ લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્ષ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, (ઓન લાઇન શિક્ષણ સિવાય) સિનેમા થીયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મંનોરંજન સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પૂલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.
૨. તમામ માર્કેટીંગ યાર્ડ, તથા તમામ માર્કેટ બંધ રહેશે. APMC માં શાકભાજી તથા ફળ- ફળાદીનું ખરીદી વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સુચનાઓનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૩. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.
૪. અંતિમ ક્રિયા / દફન વીધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે
૫. સરકારી , અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક, સંબંધિત સેવાઓ , કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈઓ લાગુ પડશે નહીં.
૬. તમામ પ્રકારના રાજકીય/સામાજિક/ધાર્મિક/ સાંસ્કૃતિક / શૈક્ષણિક, કાર્યક્રમો /મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
૭. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
૮. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પુજા/વીધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પુજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
૯. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ % પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.

૪. (૧) આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે.

(૧) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.

(૨) મેડીકલ.પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ (ચશ્માની દુકાનો સહિત)

(૩) ઓક્સિજન ઉત્પાદક અને વિતરણ વ્યવસ્થા.

(૪) ડેરી,દુધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન,વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલિવરી સેવા.

(૫) શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ ચાલુ રહેશે.

(૬) કરિયાણું,બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.

(૭) અનાજ તથા મસાલા દળવાની ઘંટી

(૮) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.

(૯) ઇન્ટરનેટ/ટેલિફોન/મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ.

(૧૦) પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા,ન્યુઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન.

- (૧૧) પેટ્રોલ,ડિઝલ,એલ.પી.જી/સી.એન.જી/પી.એન.જી ને સંબંધિત પંપ,ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ,પોર્ટ ઓફ લોડીંગ,ટર્મિનલ ડેપોઝ,પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન,ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
- (૧૨) પોસ્ટ અને કુરીયર સર્વિસ
- (૧૩) ખાનગી સિક્યુરીટી સેવાઓ
- (૧૪) પશુ આહાર ઘાસ ચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
- (૧૫) કૃષિ કામગીરી,પેસ્ટકંટ્રોલ અને આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરીવહન અને પુરવઠા વ્યવસ્થા
- (૧૬) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરીવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ
- (૧૭) આંતર રાજ્ય, આંતર જિલ્લા, અને આંતર શહેરોની ટ્રાન્સપોર્ટ સેવાઓ અને તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ
- (૧૮) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- (૧૯) બાંધકામને લગતી પ્રવૃત્તિ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૫. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટ કાળજી લેવાની રહેશે.
૬. તમામ ફેસ કવર,માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું તેમજ કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

-:શિક્ષા:-

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર THE EPIDEMIC DISEASES ACT 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઈઓ, ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, તથા, The Disaster Management Act, ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

-:જાહેર વિજ્ઞાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસિધ્ધ કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, જી.પી.એક્ટ ૧૩૫અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૧૧/૦૫/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અજયકુમાર તોમર)
પોલીસ કમિશ્નર,
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, રતથા ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.
- (૨) . નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર
- (૩). મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર
- (૪). તમામ પો.સ્ટે./ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.(નકલો ચોંટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારૂ)
- (૫) કંટ્રોલ ઈન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારૂ).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર.(નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. (જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ.)